



જાતીય હુમલો

ઓસ્ટ્રેલિયામાં કોઈપણ વ્યક્તિ પર જાતીય હુમલો કરવો એ કાનૂની ગુનો છે.

જાતીય હુમલો કરનાર વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, તેને જેલ થઈ શકે છે.

જો તમે કે તમારી ઓળખીતી વ્યક્તિ જોખમમાં હોવ તો **000** પર પોલિસને ફોન કરો.
ઓસ્ટ્રેલિયામાં પોલિસ પાસે જવું સલામત છે અને તેમનાં પર વિશ્વાસ કરી શકાય છે.

મફત અને ખાનગી સલાહ (counselling) અને માહિતી માટે 1800 RESPECT ને **1800 737 732** પર ફોન કરો.

જો તમારે મફત દુભાષિયા સેવાની જરૂર હોય તો **131 450** પર ફોન કરો.

ઓસ્ટ્રેલિયાની સરકાર (Australian Government) કોઈપણ સંજોગોમાં જાતીય હુમલો ચલાવી લેતી નથી.

જાતીય હુમલો બીજી વ્યક્તિની સંમતિ વગર તેના પર આચરવામાં આવતું કૃત્ય છે.

જાતીય હુમલામાં નીચેનાં સંજોગોનો સમાવેશ થઈ શકે છે:

- કોઈને સમાગમ કે સમાગમને લગતાં કૃત્યો કરવાં માટે બળજબરી કરવી;
- કોઈને અશ્લીલ સાહિત્ય જોવા બળજબરી કરવી; અથવા
- બાળક સાથે સમાગમ કે સમાગમને લગતાં કૃત્યો કરવાં.

સ્ત્રી કે પુરુષ સાથી, પતિ કે પત્ની અથવા પરિવારના સભ્ય પર થતો જાતીય હુમલો પણ ગેરકાનૂની કૃત્ય છે.

સ્ત્રીઓને પણ પુરુષો જેવા જ હક છે.

ઓસ્ટ્રેલિયાના કાયદા સ્ત્રીઓ અને પુરુષોને સમાન રીતે લાગુ પડે છે.

દરેકને હિંસાથી મુક્ત ખુશહાલ સંબંધો અને સમાજમાં રહેવાનો હક છે.

સ્ત્રીઓએ તેમની સાથે કરવામાં આવતું ખરાબ વર્તન કે તેમને આપવામાં આવતી ઇજાઓ સહન કરવાની જરૂર નથી.



ઓસ્ટ્રેલિયામાં જે તે સંસ્કૃતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અપાતી સેવાઓની છે જે મદદ કરી શકે છે.

1800 RESPECT એ જાતીય હુમલો, ઘરેલુ અને પારિવારિક હિંસાનો ભોગ બનેલાઓને સલાહ આપતી ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સ્તરની સેવા છે (Australia's National Sexual Assault, Family and Domestic Violence Counselling service). તે મફત અને ખાનગી સલાહ અને માહિતી, ફોન પર કે ઓનલાઇન આપી શકે છે. સલાહ આપનારાઓ તમારી વાતો સાંભળે, તમારા પ્રશ્નોના જવાબ આપી શકે અને તમારી નજીકના વિસ્તારમાં ઉપલબ્ધ બીજી મદદ કરતી સેવાઓ તરફ તમને દોરી શકે છે.

1800 737 732 પર ફોન કરો અથવા 1800 RESPECT ની વેબસાઇટ www.1800RESPECT.org.au ની મુલાકાત લો.

શું તમારે દુભાષિયાની જરૂર છે?

131 450 પર ભાષાંતર અને દુભાષિયા સેવા (**Translating and Interpreting Service**) (ટીસ) માટે મફત ફોન કરો. ટીસ તમને બીજી સેવાઓ સાથે વાતચીત કરવામાં મદદ કરશે. ટીસ દ્વારા સલાહ (counselling) આપવામાં આવતી નથી.